

ક્રમાંક : એન.એ./એસ.આર./૦૧/૨૦૧૬
 નં. જમીન/કલમ-૬૫/વશી/ ૮૩૦/૨૦૧૬
 નાયબ કલેક્ટર કચેરી, કરજણ
 તા. ૨૪/૦૫/૨૦૧૬

: વાંચ્યા :

- (૧) અરજદારશ્રી ચાવડા જીતેન્દ્રસિંહ વિજયસિંહ રહે-જુનાબજાર દશમાં ભાગ કરજણ તા.કરજણ જી.વડોદરા.તા.૦૩/૦૩/૨૦૧૬ ના રોજ ની અરજી.
- (૨) મામલતદારશ્રી કરજણનાં પત્ર નંબર જમન/વશી/૫૪૩/૨૦૧૬ તા.૧/૦૪/૨૦૧૬ થી આવેલ દરખાસ્તનાં કાગળો.
- (૩) નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણાના પત્ર નં.ટેનેન્સી/ એનએ/વશી/૯૨૬/૧૨ તા.૧૨/૦૫/૧૬ થી આવેલ અભિપ્રાય
- (૪) જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫
- (૫) જમીન મહેસૂલ નિયમોનાં નિયમ-૮૧(૨)
- (૬) ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગના, ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨૫/ક, તારીખ: ૧-૭-૨૦૦૮

: હુકમ :

- (૧) મોજે કરજણ તા. કરજણ ના રે.સ.નં. ૧૨૦૦ પૈકી તથા ૧૨૦૧/૧ ની ૧-૦૯-૨૭ ચો.મી.વાળી ખેતીની જમીન શ્રી ચાવડા જીતેન્દ્રસિંહ વિજયસિંહ રહે-જુનાબજાર દશમાં ભાગ કરજણ તા.કરજણ જી.વડોદરાના ખાતે ચાલે છે. તે આ જમીન રહેણાંકના હેતુ માટે બીન ખેતી ની પરવાનગી મળવા વંચાણ-૧ થી અત્રે અરજી કરી છે.
- (૨) માલિકી હકકપણા(ટાઈટલ) બરાબર છે જમીનના માલિકીપણા અંગે કેસ, વિવાદ કે અપીલ ચાલુમાં નથી તેમજ જમીનમાં કોઈ સરકારી લેણું વસુલ લેવાનું બાકીમાં નથી તેમ મામલતદારશ્રીએ વંચાણ-૨ થી જણાવેલ છે.
- (૩) સવાલવાળી જમીન જૂની શરતની છે. જેથી ગણોત્તર દ્વારા હેઠળ મંજૂરી લેવાનો પ્રશ્ન નથી. નાયબ કલેક્ટરશ્રી, (જ.સુ) વડોદરાના વંચાણ ૩ ના પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે.
- (૪) મામલતદારશ્રી કરજણ નાએ તપાસ કરતાં આ જમીન ઉપર બીનપરવાનગીનું બાંધકામ કે બીનખેતીનો ઉપયોગ થયો નથી. કબજેદારે પરવાનગી આપતાં ઠરાવવામાં આવે તે શરતો મુજબ વર્તવા તથા ઠરાવે તે વિ.ધારો ભરવા સંમતિ જવાબ આપેલો છે. તથા રહેણાંક હેતુ દર ચો.મી. રૂ. ૦-૧૦ પૈસા પ્રમાણે નથા પ્રવર્તમાન દરે લોકલફંડ તથા શિક્ષણ ઉપકર અને રૂપાંતરકર ભરવાની શરતે બીનખેતી પરવાનગી આપવા ભલામણ કરેલ છે.
- (૫) આ જમીન સંપાદનની કાર્યવાહી હેઠળ નથી એવું જમીન સંપાદન અધિકારીશ્રીઓએ જણાવેલ છે.
- (૬) ખાતેદારે રહેણાંક ના દર ચો.મી. રૂ. ૨-૦૦ પ્રમાણે ૧૦૯૨૭ ચો.મી. જમીનના રૂપાંતરકરની રકમ રૂ. ૨૧૮૫૪/- (અંકે રૂપીયા એકવીસ હજાર આઠસો ચોખ્ખન પુરા) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કરજણ શાખામાં "૦૦૩૫" સદરે તા. ૨૬/૦૫/૨૦૧૬ ના રોજ જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે. તેમજ અગાઉ જીલ્લા નીરીક્ષકશ્રી જમીન દફતર વડોદરા ધ્વારા માપણી કરાવી માપણી શીટની નકલ રજુ કરેલ છે. તથા માપણી ફીની રકમ રૂ. ૧૮૦૦/- સરકારશ્રીમાં જમા કરાવ્યા બાબતના પાવતીની નકલ રજુ કરેલ છે.
- (૭) સબબ, મોજે કરજણ તા. કરજણ ના સર્વે નંબર ૧૨૦૦ પૈકી તથા ૧૨૦૧/૧ ની ૧-૦૯-૨૭ ચો.મી. વાળી ખેતીની જમીનનો પત્રક મુજબ રહેણાંકના ના રૂ. ૦-૧૦ પૈસા પ્રમાણે રૂ. ૧૦૯૩-૦૦ વિ. ધારો તથા અન્ય ઉપકરો પ્રવર્તમાન દરે તા. ૧/૮/૨૦૧૬ થી બીજો હુકમ થતાં સુધી દર વર્ષે ભરવાની થાય છે. તથા ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક બખપ/૧૦૦૬/૪૨૫/ક તા. ૮/૪/૨૦૧૧ અન્વયે સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવેલ નકશા અને શરતો પ્રમાણે તથા નગરપાલિકા કરજણની રજાચિટ્ટી મેળવી બાંધકામ

કરવાની શરતે બીનખેતીના રહેણાંકનાં હેતુ માટે પરવાનગી આપવા નીચેની વધુ શરતોને આધીન હુકમ કરવામાં આવે છે.

: શરતો :

- (૧) ડીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ ધ્વારા ઈસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મૂળ ટિપ્પણી હદ પણ દર્શાવેલ હોવી જોઈએ. રજૂ કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સક્ષમ કક્ષાએ મંજૂર કરાવવા હોવો જોઈશે.
- (૨) બાંધકામ શરૂ કરતાં પહેલા બાંધકામના નકશા સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે, પરંતુ અરજદાર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચીકી મેળવી શકશે નહીં.
- (૩) શહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યાં જી.ડી.સી. આર. અને ઝોનીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
- (૪) મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
- (૫) અરજદારે રીબન ડેવલપમેન્ટ રૂલ્સ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.
- (૬) ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી માંગેલ હોય તો બાંધકામ કરતાં પહેલા જિલ્લા ઉદ્યોગ અધિકારીની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૭) ફ્લોર મીલ, સિનેમા/ટુરીંગ સિનેમા/ થીયેટર માટે બિનખેતી પરવાનગીના કામે જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૮) પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સી.એન.જી., એલ.પી.જી. પંપ નાંખવા માટે બિનખેતી પરવાનગીના કામે બાંધકામ શરૂ કરતાં પહેલાં જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૯) ઈન્ડિયન એક્ષપ્લોઝીવ એક્ટ અન્વયે મેગેનીઝ, ફાયરવર્ક્સ, દારૂખાના માટે બિનખેતીની કાર્યવાહી કરતાં પહેલાં જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૧૦) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૧૧) સવાલવાળી જમીન જો રેલ્વે હદની નજીક હોય તો રેલ્વેની હદથી ૩૦ મીટર જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વિજળી ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર અગર થાંભલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવા અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- (૧૩) બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસના ૨૦ કી.મી.ની ત્રિજ્યામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉચાઈ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું 'ના વાંધા પ્રમાણપત્ર' સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૪) ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઈન્સ્ટોલેશનથી ૮૦૦ મીટરની ત્રિજ્યા બહાર બાંધકામ કરવાનું રહેશે.
- (૧૫) ઓ.એન.જી.સી.ના કુવા નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૬) નર્મદા કેનાલ/અન્ય સિંચાઈ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સૂચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૭) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (PROTECTED MONUMENTS) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૮) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વન/જમીનથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૯) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ્ય અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેર કરેલ કોઈપણ વિસ્તારની હદથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

અરજદારે ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિઠ્ઠળ જશે તો શરતભંગ ગણી સક્ષમ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.

- (૨૦) બાંધકામ શરૂ કર્યા તારીખથી એક માસમાં અને બાંધકામ પુરૂ કર્યા તારીખથી એક માસમાં એમ બન્ને પ્રસંગોએ લેખીતમાં જાણ કરવી પડશે.
- (૨૧) આ જમીન ઉપરનું મંજૂર થયા પ્રમાણે બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પુરું કરવાનું રહેશે. તેમ કરવામાં ચુક થયે કલમ-૬૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને વસુલ ભરેલો વિ.ધારા વિગેરે કોઈપણ સંજોગોમાં પરત મેળવવાનો હકક રહેશે નહિ. આ અંગે અપીલનો સમય પૂરા થયા બાદ કોઈ હકક રહેશે નહિ.
- (૨૨) રજાચિઠ્ઠી, લેઆઉટ પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાનાં પ્રસંગે સક્ષમ અધિકારીશ્રી / નાયબ કલેક્ટરશ્રી હુકમ કરે તે સમયમાં દૂર કરવાનું રહેશે. અને તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કબજેદારને ખર્ચે દૂર કરાવવામાં અને ખર્ચ જમીન મહેસુલ બાકી રાહે વસુલ કરવાપાત્ર થશે. અને નાયબ કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવો પડશે.
- (૨૪) હુકમ થયા તારીખથી છ માસની અંદર કબજેદારે જમીન મહેસુલ કાયદામાં જણાવ્યા મુજબ નમુના "એમ" માં સનદ ભરી આપવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવાનો રહેશે. ઉક્ત સનદ અપીલનો સમય પુરો થયા બાદ ભરી આપવાની રહેશે.
- (૨૫) "વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન /બહુમાળી મકાન (નકશા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાતંત્રએ આપેલ મંજૂરી મુજબ) દીઠ એકના દરે પરકોલેટીંગ બોરની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે. "
- (૨૬) ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓ અનુસાંગિક સરકારશ્રી ધ્વારા નક્કી થયેલ નિયમો/વિગતોએ સવાલવાળી જમીનનું સોઇલ ટેસ્ટીંગ કરાવી નેશનલ બીલ્ડીંગ કોડને આધીન બાંધકામની સ્ટ્રક્ચરલ ડિઝાઇન સ્ટ્રક્ચરલ એન્જીનીયરશ્રી પસંદે તૈયાર કરાવી તેઓશ્રીના દેખરેખ/માર્ગદર્શન મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- (૨૭) નામદાર હાઇકોર્ટના સ્પે.સિવિલ એપી.નં-૧૦૬૨૧/૨૦૦૦થી અપાયેલ સૂચના મુજબ તળાવ,કાંસ,નદી,નહેર,નાળા અને કેમ્પ વિસ્તાર નજીક આવતી બિનખેતી થયેલ જમીનમાં બાંધકામની પરવાનગી આપતી વખતે ઉપરોક્ત આદેશમાં રાજ્ય સરકારને અમલ કરવા માટે સૂચનનો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.
- (૨૮) નગર નિયોજકશ્રી વડોદરા તરફથી મંજૂર કરવામાં આવેલ લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે જમીન જાહેર રસ્તા વિગેરે જાહેર હેતુ માટે વગર વળતરે ખુલ્લી રાખવાની રહેશે. અને લે-આઉટ પ્લાન પ્રમાણેના આંતરીક રસ્તા કરવાની જવાબદારી અરજદારશ્રીની રહેશે. અને આંતરીક રસ્તા કર્યા પછી જ બીજા બાંધકામ કરી શકશે.
- (૨૯) સહિયારા કોમન પ્લોટ અને રસ્તાની જમીન સોસાયટીની સહિયારી માલીકીની અથવા સર્વે પ્લોટ હોલ્ડરની સહિયારી માલીકીની ગણાશે. તે ઉપર મુળ માલીકનો કોઇ હક્ક રહેશે નહિ.
- (૩૦) બાંધકામનાં નિયમોની જોગવાઇ પ્રમાણે સોસાયટીના સહિયારા ઉપયોગ માટે કલબ,ઓફીસનું મકાન સહકારી ભંડાર બાંધવા કોમન પ્લોટનાં ૧/૬ જેટલા ભાગનાં ક્ષેત્રફળમાં બાંધકામ કરવા પ્લોટ હોલ્ડર ઇચ્છે તો મંજૂરી મેળવી તેમ કરી શકશે.
- (૩૧) ઉપર-(૩૦) માં જણાવ્યા સિવાયનાં કોઇ પણ હેતુ માટે તે સાર્વજનિક ઉપયોગ હોયતો પણ કોમન પ્લોટમાં બાંધકામ કરી શકાશે નહિ.
- (૩૨) રસ્તા અને કોમન પ્લોટની જમીનનું હરાજીથી,બક્ષીસથી કે અન્ય કોઇ રીતે વેચાણ કે તબદીલ થઇ શકશે નહિ.
- (૩૩) સાર્વજનિક પ્લોટ-રસ્તા સહિતની સમગ્ર જમીનનો બીનખેતી આકાર પ્લોટો,વેચાણ કરવામાં આવે ત્યાં સુધી મુળ ખાતેદારે અને પ્લોટ વેચાણ કર્યાથી તમામ પ્લોટ હોલ્ડરે પ્રમાણસર ભરવાનો રહેશે.

- (૩૪) કોમન પ્લોટ રસ્તાની જમીનનું રાજીનામું આપે ત્યારે બિનખેતી આકાર કમી કરવાનો થાય છે. તેમ છતાં રસ્તા અને કોમન પ્લોટનો ઉપયોગ સોસાયટીના રહિશોબે જ સહિયારો કરવાનો રહે છે.
- (૩૫) આ જમીનનો વિશેષધારો રહેણાંક ના હેતુના કામે હે.૧-૦૯-૨૭ ચો.મી.જમીનના રહેઠાણ હેતુસર રૂ. ૧૦૯૩/-વિશેષધારો તા.૧/૦૮/૨૦૧૫થી પ્રવર્તમાન દરે બીજા હુકમ થતાં સુધી દર વર્ષે તથા નિયત દરે લોકલ ફંડ શેષ,શિક્ષણ ઉપકર વિગેરે અન્ય કરો વિશેષધારા ઉપરાંત ભરવાનો રહેશે.
- (૩૬) ઉપરની કોઇ પણ શરત અગર સનંદમાં જણાવેલી શરતો પૈકી કોઇ પણ શરતનો ભંગ થયા પ્રસંગે જમીન મહેસુલ કાયદામાં જણાવેલી શિક્ષાને કબજેદાર પાત્ર અને તેનો બાધ લીધા સિવાય નાયબ કલેક્ટરશ્રી કરજણ જે પગલાં લેશે તે કબજેદારને બંધનકર્તા રહેશે.



(કે.સી.ભગત)
નાયબ કલેક્ટર, કરજણ

રજી.પોસ્ટ એડી.ધી
પ્રતિ,
ચાવડા જીતેન્દ્રસિંહ વિજયસિંહ
રહે-જુનાબજાર દશમાં ભાગ કરજણ
તા.કરજણ જી.વડોદરા
નકલ જયભારત સહ રવાના :-

- (૧) ચીફ ઓફીસરશ્રી, કરજણ નગરપાલિકા, કરજણ, જી.વડોદરા તરફ
- (૨) મામલતદારશ્રી કરજણ તરફ (હુકમની નકલ બે પ્રતમાં)
એક પ્રત તાલુકા નમુના નં. ૪ માં ઉપજની નોંધ કરાવી ગામ દફતરે રાખવા મોકલવા તથા વિ.ધારાની રકમ સને ૨૦૧૫-૨૦૧૬નાં હિસાબોમાં સાધવા તથા ગામે તા.નં. ૨ તથા ૭/૧૨માં વિ.ધારાની નોંધ કરાવવા અને નિયમ પ્રમાણે આગળની તજવીજ કરવા સારું.
- (૩) જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર વડોદરા.
૨/-જરૂરી કાર્યવાહી થવા સારું અને માપણી ફી વસુલ થયેલ છે જે જાણ સારું તથા વધ ઘટ હોય તો બે માસમાં રીપોર્ટ કરવા સારું.
- (૪) સીટી સર્વે સુપ્રિ.શ્રી કરજણ તરફ.
- (૫) નાયબ નગર આયોજન અધિકારીશ્રી, નર્મદા ભુવન વડોદરા તરફ

બીનવેતીની પરવાનગી માંગેલ જમીનનો સ.નં., ક્ષેત્રફળ તથા કબજેદારનું નામ	બીનવેતીની પરવાનગી માંગેલ જમીનનું ક્ષેત્રફળ	નિયમ મુજબ લેવાનો વિશેષ ધારાની રકમ	વસુલ કરવાની વિશેષ ધારાની રકમ	રૂપાંતરકર લેવાની વિગત	લોકલ ફંડની વિગત	શિક્ષણ ઉપકરની રકમ	કોલમ-૪નો વિ.ધારો કઈ તારીખથી લેવાનો છે તેની વિગત.
૧	૨	૩	૪	૫	૬	૭	૮.
મોજે કરજણ તા. કરજણના રે.સ.નં. ૧૨૦૦ પૈકી તથા ૧૨૦૧/૧ ની ૧-૦૯-૨૭ ચો.મી. રહેણાંક માટે ચાવડા જીતેન્દ્રસિંહ વિજયસિંહ રહે-જુનાબજાર દશમાં ભાગ કરજણ તા.કરજણ જી.વડોદરા	ચો.મી. ૧-૦૯-૨૭	રહેણાંક ના હેતુના દરે દર ચો.મી.ના ૦-૧૦ પૈસા પ્રમાણે	રૂ. ૧૦૯૩-૦૦ (અંકે રૂપિયા એક હજાર નવ્વાણુ પુરા)	રૂ. ૨૧૮૫૪/- (અંકે રૂપિયા એકવીસ હજાર આઠસો ચોપ્પન પુરા)	રૂ. ૫૪૭/- (અંકે રૂપિયા પાંચસો સુડતાલીસ પુરા)	રૂ. ૨૭૪/- (અંકે રૂપિયા બસો ચુમોતેર પુરા)	તા. ૧/૮/૨૦૧૫ થી

નોંધ:- રૂપાંતરકરની રકમ રૂ. ૨૧૮૫૪/- (અંકે રૂપિયા એકવીસ હજાર આઠસો ચોપ્પન પુરા) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરજણ શાખામાં ચલનથી તા. ૧૯/૦૫/૨૦૧૬નાં રોજ જમા કરાવવામાં આવેલ છે.



11

(કે.સી.ભગત)

નાયબ કલેક્ટર વડોદરા